

પિયત આપવું, ધરું ઉછેર દરમ્યાન પાક સંરક્ષણાના પગલા લેવા. ધરું જ્યારે 30 થી 35 દિવસના ૧૫ થી ૨૫ સે.મી. ઉચ્ચાઈના થાય ત્યારે ફેર રોપણી કરવી.

**વાવેતર સમય તથા ફેરરોપણી :-** ધર્મવાડિયામાં ધર્મનું વાવેતર ચોમાસુ પાક માટે જુન માસ, શિયાળુ પાક માટે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં વાવેતર કરવું. ઉનાંનું અતુમાં આ પાકનું વાવેતર ન કરવું. ટામેટાના ધરું જ્યારે 30 થી 35 દિવસના થાય ત્યારે ફેરરોપણી કરવી. કીટરમીનેટ (નિયંત્રિત વૃદ્ધિવાળી) જાતો માટે ૭૫ X ૫૦ અથવા તો ૭૫ X ૪૫ સે.મી. અંતરે ફેરરોપણી કરવી. જ્યારે ઇનડીટરમીનેટ જાતો (અનિયંત્રિત વૃદ્ધિવાળી) જાતો માટે ૬૦ X ૫૦ સે.મી. ના અંતરે ફેરરોપણી કરવી. ચોમાસુ પાક માટે જુલાઈમાં તથા શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ફેરરોપણી કરવી.

**ખાતરઃ :-** જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૨૦ ટન છાણિયું ખાતર આપવું. સુધારેલ જાતો માટે ૭૫:૭૫:૨:૫ ના ફો.પો. તથા હાઇબ્રિડ જાતો માટે ૧૫૦:૭૫:૭૫ ના ફો.પો. પ્રતિ હેક્ટરે આપવું. આમાંથી બધો ફોસ્ફરસ તથા પોટાશ ફેરરોપણી સમયે પાચાના ખાતર તરીકે આપવો. નાઈટ્રોજન ખાતર ને સરખા હસમાં વાપણી બાદ ૩૦ તથા ૫૦ દિવસે આપવું.

**આંતરખેડ તથા નિંદામણા :-** પાકની શરૂઆતની અવસ્થાએ તુંબા ૪ વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ તુંબા ૪ વખત નિંદામણ કરવું. મજુરની અછત સમયે ફેરરોપણી બાદ વરાપે ચેનીભીથાલીન / ફુલકલોરાલીન / કચુટાકલોર એક કિ.ગ્રા. સંક્ષિપ્ત તત્ત્વ ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી પાછા પગલે છંટકાવ કરવો.

**પિયત :-** પાકની ફેરરોપણી બાદ પ્રથમ પિયત ફેરરોપણીના દિવસે જ આપવું. ત્યારબાદ બીજું પિયત ફેરરોપણી બાદ ચોથા દિવસે આપવું. ત્યાર પછી જમીનની પ્રતિ મુજબ શિયાળામાં ૮ થી ૧૦ દિવસે અને ઉનાળામાં ૫ થી ૭ દિવસે પાણી આપવું. ટપક પદ્ધતિ માટે ચાર લિટર / કલાક ક્ષમતા વાળા ૧૨૦ સે.મી. ના અંતરે ડ્રીપર ગોઠવી આંતરે દિવસે નવેમ્બર-જાન્યુઆરી માસમાં એક કલાક તથા ફેલુઆરી-માર્ચ માસમાં દોઢ કલાક પ્રમાણે પિયત આપવું.

#### પાક સંરક્ષણ રોગો :-

(૧) પાનનો સુકારો :- પાન ઉપર કદ્ધાઈ રંગના કાટખૂણિયા ટપકા થાય છે. રોગ દેખાતા તુરેંત જ મેન્ડોઝેબ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં ભેણવી ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.

(૨) પાનનો કોકડવા :- પાન કોકડાય જાય, ખરબચડા તથા જાડા થઈ જાય છે. આ રોગ સફેદ માખીથી ફેલાય છે. તેથી હોસ્ટાથીયોન ૧૫ મી.લી. / ૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.

#### (બ) કિટકો :-

૧. લીફ માધ્યનોર :- ધર્મવાડિયા અવસ્થાને તેમજ ફેરરોપણી બાદ પાનના બે પડ વચ્ચે સર્પાકારે કોરી જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે મોનોકોટોફોસ ૧૦ લિટર પાણીમાં ૧૦ મી.લી. અથવા ડાયભીથોએટ ૧૦ લિટર પાણીમાં ૧૦ મી.લી. અથવા ડી.ડી.વી.પી. ૦૫ મી.લી. ૧૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.

(૨) ફળ કોરી ખાનાર દિયણ :- ફળો કોરીને અંદરનો ભાગ ખાય છે. ફળમાં કાણા પાડે છે. આ દિયણના નિયંત્રણ માટે કાર્બોરીલ ૪૦ ગ્રામ અથવા કવીનાલફોસ ૨૦ મી.લી. અથવા સાયપરમેથીન ૦૭ મી.લી. ૧૦ લિટર પાણીમાં નાખીને વારાફરતી છંટકાવ કરવો. આ ઉપરાંત ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો. પાકને ફરતા હજારી ગલગોટાનું વાવેતર કરવું.

**વીણી તથા ઉત્પાદન :-** ટામેટાના પાકમાં પ્રથમ વીણી ૭૦ થી ૭૫ દિવસે આવે છે. જ્યારે ટામેટાનો રંગ લીલામાંથી રતાશ પડતો થાય ત્યારે વીણી કરવી. નિયંત્રિત વૃદ્ધિના ગૃહીતમાં ૧૦ થી ૧૨ વીણી આવે છે. જ્યારે અનિયંત્રિત વૃદ્ધિના ગૃહીતમાં ૧૫ થી ૨૦ વીણી આવે છે. ટામેટાનું સરેરાશ ઉત્પાદન ૨૫ થી ૩૦ હજાર કિલો પ્રતિ હેક્ટરે મળે છે.



## ટામેટાની પૈણાનિક ખેતી પદ્ધતિ



: લેખક :  
મિલન બ્રહ્મભટુ

: પ્રકાશક :

### વરીષ પૈણાનિક-૫-૫૮

#### કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

#### મંગલભારતી

મુ. પો. ગોલાગામડી,  
તા. સખેડા, જુહો -છોટાઉંડેપુર  
(ગુજરાત) ૩૬૧૧૨૫  
ફોન. ૦૨૯૫-૨૪૩૨૪૦

ટામેટા દુનિયાના મોટાભાગના વિસ્તારમાં વાવેતર થતો અગત્યનો શાકભાજુ પાક છે. ગુજરાતમાં અંદાજીત ૨૨ થી ૨૫ હજાર હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. આણંદ, બેડા, વડોદરા, અમદાવાદ, સુરત, મહેસાણા, ભરૂચ જિલ્લાઓમાં ટામેટાનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે. ટામેટાનો ઉપયોગ રોજુંદા શાકભાજુ દાળ કંચુબર તેમજ કેચઅપ, સુપ, સોસ, જામ, જેલી, પ્યોરી જેવી બનાવટોમાં પણ બહોળા પ્રમાણમાં થાય છે.

**આબોહવા :-** ટામેટાના પાકને મધ્યમ માફકસરની આબોહવા અનુકૂળ આવે છે. મધ્યમ ગરમ વાતાવરણમાં છોડની વૃદ્ધિ સારી થાય છે. અતિશય ગર્ભીને લીધે છોડની વૃદ્ધિ તેમજ ફળો બેસવા પર માઠી અસર થાય છે. ફળ બેસવાના સમયે હંકીની જરૂર રહે છે. સામાન્ય રીતે ૧૮ થી ૨૫ સે. તાપમાન વધારે માફક આવે છે.

**જમીન :-** ટામેટાના પાકને ગોરાકુ, મધ્યમ કાળી અથવા ભાડાવાળી જમીન કે જેણી નિતાર શક્તિ સારી હોય તેમજ સેન્દ્રિય તત્ત્વ પુરતા પ્રમાણમાં હોય તેવી ફળદુંપ જમીન વધુ માફક આવે છે.

#### સુધારેલી જાતો

૧ નિયંત્રિત વૃદ્ધિવાળી જાતો (કીટરમીનેટ ગૃપ)	ગુજરાત ટામેટા-૨, અવિનાશ-૨, પુસા હાઇબ્રિડ-૨, એઓરટીએચ-૩, એએન-૫૦૧, એએચાઈ-૩૦૩
૨ અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો (ઇન કીટરમીનેટ ગૃપ)	ગુજરાત ટામેટી-૧, હિમસોના, હિમશિખર, અભિનવ, એનએસ-૨૫૩૫, બીએસએ-૨૦૦
૩ પ્રાધિકેટ કંપનીની જાતો	વૈશાલી, રૂપાલી, મહાબોલેશ્વર-૨ વગેરે

#### ધરું ઉછેર :-

એક હેક્ટરના વાવેતર માટે ૧૫૦ ચો.મી. ના ધર્મવાડિયાની જરૂરીયાત રહે છે. આ માટે ધર્મવાડિયામાં ૧ ટન છાણિયું ખાતર અથવા ૧૦ કિલો દિવેલીનો ખોળ, ૦૧ કિલો કીએપી, ૫૦૦ ગ્રામ પોટાશ તથા ૩૦૦ ગ્રામ કાબોંક્યુરાન દવા ધર્મવાડિયાનું તૈયાર કરતી વખતે જમીનમાં ભેણવંનું, ત્યારબાદ ૫ થી ૮ મીટર લંબા તથા ૨ થી ૨.૫ મીટર પહોળા ગાદી કચારા બનાવવા. હાઇબ્રિડ ટામેટા માટે હેક્ટરે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ તેમજ અન્ય જાતો માટે હેક્ટરે ૨૦૦ થી ૨૫૦ ગ્રામ બીજાની જરૂરીયાત રહે છે. બીજ વાવેતર બાદ હળવું